



Voltamp Transformers Limited

Ref: VTL/SEC/17NSE-BSE/

Date: November 15, 2017

To,
NATIONAL STOCK EXCHANGE OF INDIA LTD.
Listing Department "Exchange Plaza,"
Bandra -Kurla Complex,
Bandra (E),
Mumbai 400 051

To,
BSE LIMITED
Department of Corporate Services,
Floor 1, Rotunda Building,
P J Towers, Dalal Street,
Mumbai 400 001

Scrip Code: VOLTAMP EQ

Scrip Code: 532757

Dear Sir,

**Sub: Newspaper Advertisement for Transfer of Equity Shares to Investors
Education Protection Fund Authority ("IEPF Authority")**

In compliance of Regulation 30 of SEBI (LODR) Regulations, 2015, we submit herewith Notice published in newspapers as required under Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended from time to time ("IEPF Rules") inviting attention of concerned shareholders to submit their claims in respect of unclaimed dividends of the Company for last seven consecutive years by 20th November, 2017 failing which their shares would be transferred to IEPF authority in accordance with Section 124(6) of the Companies Act, 2013 and rules made thereunder.

You are requested to take the above on record.

Thanking you,

Yours faithfully,
For **VOLTAMP TRANSFORMERS LTD.**


SANKET RATHOD
Company Secretary

Encl: as above

1	Net Income	594.82	1,054.98
2	Net Profit		



VOLTAMP TRANSFORMERS LIMITED
 CIN: L31100GJ1957PLC001437
 Regd. Office : Makarpura, Vadodra-390014, Gujarat (India)
 Phone : +91 265 2642011 / 2642012 / 3041480, Fax : +91 265 2646774 / 3041499
 E-mail : voltamp@voltamptransformers.com, Website : www.voltamptransformers.com

NOTICE TO SHAREHOLDERS
TRANSFER OF EQUITY SHARES TO INVESTOR EDUCATION & PROTECTION FUND (IEPF) AUTHORITY

This Notice is published pursuant to the provisions of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") notified by the Ministry of Corporate Affairs effective 7th September, 2016 and amended from time to time.

The Rules, inter alia, provide for transfer of all shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years to the Investor Education and Protection Fund Authority ("IEPF Authority") set up by the Central Government. Accordingly, the Company has sent individual communication to those shareholders whose shares/ dividend are liable to be transferred to IEPF Authority during FY 2017-2018 under the said Rules at their latest available address. The Company has uploaded the details of such shareholders and shares due for transfer to IEPF on its website at www.voltamptransformers.com. Shareholders are requested to refer to the website of the Company to verify the details of the shares liable to be transferred to IEPF Authority.

Notice is hereby given to all such shareholders to make an application to the Company/ Registrar by 20.11.2017 with a request for claiming the unpaid dividend and the shares transferred to IEPF Authority. It may please be noted that if no reply is received by the Company or the Registrar by 20.11.2017 the Company will be compelled to transfer the shares to the IEPF, without any further notice.

It may also be noted that the shares transferred to IEPF, including all benefits accruing on such shares, if any, can be claimed back from the IEPF Authority as per the procedure prescribed by the IEPF Rules.

For any clarification on the matter, please contact the Company's Registrar and Transfer Agents: M/s. Link Intime India Pvt. Ltd., B- 102 & 103, Shangria Complex, Near Radhakrishna Char Rasta, Vadodra - 390020.

Tel No.: 0265-235657 - 2356794,
 email: vadodara@linkintime.co.in,
 website: www.linkintime.co.in

For, Voltamp Transformers Ltd.
Sanket Rathod
 Company Secretary

Place : Vadodra
 Date : November 10, 2017

Bharat Heavy Electricals Limited
 (A Govt. of India Undertaking)

TRANSMISSION BUSINESS GROUP, TBM, SECTOR-142, NOIDA-201 305
 Phone No. 0120-4744424 / 8442

NOTICE INVITING TENDER AND CORRIGENDUM

Solicited bids are invited for various works. The description of work and NIT numbers are as under:

- NIT No. 35484: ETC works of 400/220kV substation at Tankur (Pavagada) in Karnataka.
- NIT No. 35485: ETC works of 400/220kV substation at Tankur (Veeranraopur) in Karnataka.
- NIT No. 35486: ETC works of 400kV substation at Mysore in Karnataka.
- NIT No. 35487: Survey and design of 220kV & 132kV transmission line at Paratu in Jharkhand.
- NIT No. 34737: Pre-qualifying requirement for civil design consultancy work of 400/220kV substation at Malba in Bangladesh has been revised.

For other details refer respective NIT in tender notifications on www.bhel.com. All amendments, time extensions, clarifications, etc. will be uploaded on this website only. Bidders should regularly visit this website to keep themselves updated.

Government of India
 Ministry of Finance
DEBTS RECOVERY TRIBUNAL-II
 3rd Floor, Bhikhubhai Chamber, Near Kochrab Ashram, Paidi,
 Ahmedabad-380 006, Phone No.: 079-26578343, Telex Fax : 078-29579341

Form No.14 [See Regulation 33(2)]

R.P.No. 155/2019	O.A.No. 473/2013
Bank Of Baroda,	Certificate Holder Bank.
	VS
M/s. Hiran Silk Fabrics	Certificate Debtors

DEMAND NOTICE
(THROUGH PAPER PUBLICATION)

TO,

CD No.1: M/s Hiran Silk Fabrics, A Sole Proprietary concern,
 Plot No. 500, Unity Industrial Estate, Pandesara, Surat-394 221.

CD No.2: Mrs. Kanyanaben Natwarbhai Patel, 102, Sindh Sahyog
 Apartment, Sarvodaya Nagar, pandesara, Surat-394 221.
 And also at : 104, Yogesh Apartment, Nr. Sitaram Bapa Char Rasta,
 Odhar Gam, Odhar, Ahmedabad.

CD No.3 : Mr. Natwarbhai Kashiram Patel, 102, Sindh Sahyog
 Apartment, Sarvodaya Nagar, pandesara, Surat-394 221.
 And also at : 104, Yogesh Apartment, Nr. Sitaram Bapa Char Rasta,
 Odhar Gam, Odhar, Ahmedabad.

CD No.4:- Mr. Devchandbhai Rameshchandra Panchal,
 404, Yogesh Apartment, Nr. Sainath Society, B/h Jvanjyot Cinema,
 Surat-394 221.

In view of Recovery Certificate issued in O.A.No.473/2013 passed by the Hon'ble presiding Officer, Debts Recovery Tribunal-II, Ahmedabad, an amount of Rs.61,05,833.00 (Rupees Sixty One Lakh Five Thousand Eight Hundred Thirty Three Only) including interest as on 23/12/2013 and further interest from 24/12/2013 Plus cost of Rs.96,000/- is due against You.

You are hereby called upon to deposit the above sum within 15 Days of the receipt of the notice, failing which the recovery shall be made as per rules.

In addition to the sum aforesaid you will be liable to pay:

- Such interest and cost as is payable in terms of Recovery Certificate.
- All Costs, Charges and expenses incurred in respect of the service of this notice and other process that may be taken for recovering the amount due.

GIVEN UNDER MY HAND AND SEAL OF THE TRIBUNAL, ON THIS
 08/10/ 2017. (JAI SINGH)
RECOVERY OFFICER-II
 Debts Recovery Tribunal-II, Ahmedabad.

Next Date : 16/11/2017

